



ઓનલાઇન ફાયરવર્ક્સ વેન્ડર ટ્રેઇનિંગ (ફટાકડાં વિક્રેતા તાલીમ) શરૂ થઈ

બ્રમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 15, 2021) – સીટી ઓફ બ્રમ્પટને આ વર્ષે ફટાકડા વેચવાનું આયોજન કરતા વિક્રેતાઓ માટે ઓનલાઇન તાલીમ પ્રક્રિયા શરૂ કરી છે.

તાલીમ લેવી ફરજિયાત છે અને વિક્રેતાઓ વેચાણ કરવાનું લાઇસન્સ મેળવી શકે તે પહેલાં આ અભ્યાસક્રમ ફરજિયાત લેવાનો રહે છે.

અભ્યાસક્રમ માટે નોંધણી કરાવવા, વિક્રેતાઓ બ્રમ્પટન ફાયર પ્રિવેન્શનને 905.874.2740 નંબર પર કોલ અથવા ઈમેઇલથી fire.prevention@brampton.ca સંપર્ક કરી શકે છે અને અભ્યાસક્રમની વિગતો અરજદારને ઈમેઇલથી મોકલવામાં આવશે.

COVID-19 માટે આરોગ્ય અને સુરક્ષા પ્રતિબંધો અમલમાં હોવાને લીધે, તાલીમ ઓનલાઇન સ્વરૂપે પાંચ સરળ પગલાઓમાં આપવામાં આવશે:

1. 2021 ફાયરવર્ક્સ રિટેઇલર કોર્સ માટે ચૂકવણી કરો અને [ફાયર ઈન્સ્પેક્શન](#) માટે અરજી કરો
2. ફાયરવર્ક્સ રિટેઇલર તાલીમ વીડિયો જુઓ
3. ફાયરવર્ક્સ રિટેઇલર પ્રશ્નાવલી ભરો
4. લાઇસન્સ અરજી અને નોંધણી ફી જમા કરાવો. વિગતો માટે ઈમેઇલથી licensing@brampton.ca સરનામે સંપર્ક કરો.
5. 2021 ફાયરવર્ક્સ રિટેઇલર લાઇસન્સ રૂબરૂમાં સીટી હોલમાંથી મેળવો. હોલની મુલાકાત લેતા પહેલાં એપોઇન્ટમેન્ટ લેવી અનિવાર્ય છે અને તેનું બુકિંગ અહીં કરી શકાય છે, www.brampton.ca/skipthehline.

ફટાકડા વિક્રેતા તાલીમમાં વેચાણ કરવાની છૂટ અપાતા ફટાકડાના પ્રકારો, સંગ્રહ કરવાને લગતા નિયમો, ફટાકડાનું પ્રદર્શન અને વેચાણ, ગ્રાહક આઈડી જરૂરિયાતો અને ખરીદનારાઓને વિતરણ માટે સુરક્ષા માર્ગરેખાઓ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે.

બહુવિધ સ્થળો ધરાવતા વિક્રેતાઓ માટે, અભ્યાસક્રમ પૂરો કરવા દરેક સ્થળેથી ઓછામાં ઓછાં એક ઓપરેટરની જરૂર પડે છે. વિક્રેતાઓએ એ પણ નોંધવું રહ્યું કે ફાયર ઈન્સ્પેક્શન માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ પ્રમાણે છે:

- શુક્રવાર, એપ્રિલ 30, 2021 - વિક્ટોરિયા ડે ફાયરવર્ક્સ માટે
- શુક્રવાર, જૂન 11, 2021 - કેનેડા ડે ફાયરવર્ક્સ માટે
- શુક્રવાર, ઓક્ટોબર 15, 2021 - દિવાળીમાં ફટાકડાં માટે
- શુક્રવાર, ડિસેમ્બર 10, 2021 - ન્યૂ ઈયર્સ ઈવ પર ફટાકડાં માટે

સીટી ઓફ બ્રમ્પટનનો બાય-લો (પેટા-કાનૂન) માત્ર ટૂંકા અંતરના ફટાકડાનું વેચાણ અને અંગત વપરાશ (સળગાવવામાં આવે ત્યારે 3 મીટર કે 10 ફૂટથી ઓછાં અંતર સુધી ઉડે તેવા ફટાકડા) વર્ષમાં ચાર વખત - વિક્ટોરિયા ડે, કેનેડા ડે, દિવાળી અને નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ કરવાની પરવાનગી આપે છે.



BRAMPTON

Service and Information Update

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया ऐन्ड कम्युनिटी ॲंगेजमेन्ट

व्यूडाल्मक संवाढ

सीटी ओफ् ब्रॅम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca